
	<p>પોલીસ કમિશ્નરની કચેરી, સુરત શહેર. પોલીસ ભવન, અઠવાલાઇન્સ, સુરત શહેર-૩૯૫૦૦૧ વિશેષ શાખા, કચેરી ટેલીફોન-૦૨૬૧ ૨૨૪૧૧૧૦ કંટ્રોલ રૂમ ફેક્સ નં. ૦૨૬૧ ૨૨૪૧૩૦૪ e-mail : special.cp.sur@gmail.com</p>	 <p>एक कदम स्वच्छता की ओर</p>
---	--	--

:: જાહેરનામું ::

:: ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને - ૧૯૭૩ ની કલમ - ૧૪૪ અન્વયેનું જાહેરનામું ::-

ક્રમાંક: એસ.બી/ પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) પરીક્ષા/૦૨/૨૦૨૧
 આગામી તા.૦૩/૦૧/૨૦૨૧ ના ક.૧૧/૦૦ થી ક. ૧૪/૦૦ સુધી પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ-૨ ની પરીક્ષા લેવાનાર છે. જે પરીક્ષા સુરત શહેર ખાતે નીચે મુજબનાં પરીક્ષા કેન્દ્રો ઉપર (સ્કુલો/હાઈસ્કુલો)માં લેવામાં આવનાર છે. જેથી પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં શાંતિમય વાતાવરણ રહે તેમજ પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીનાં હેતુસર પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે ચાર થી વધુ વ્યક્તિઓ ભેગા થવાની, સભા ભરવાની કે સરઘસ કાઢવાની મનાઈ ફરમાવવાનું જરૂરી જણાય છે.

વાસ્તે, હું અજયકુમાર તોમર (આઈ.પી.એસ.) પોલીસ કમિશ્નર, સુરત શહેર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને ૧૯૭૩(૧૯૭૪ ના નં.૨)ની કલમ-૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ આથી હું હુકમ કરુ છું કે, સુરત શહેરમાં પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવું છું કે,

:: પ્રતિબંધિત કૃત્યોની યાદી ::

- (૧) કોરોના વાયરસ અનુસંધાને પરીક્ષા કેન્દ્રો પર આવનાર તમામ વ્યક્તિઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.
- (૨) પરીક્ષા કેન્દ્ર ખાતે આવનાર તમામ વ્યક્તિઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.
- (૩) પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ.
- (૪) પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમિયાન ચાલુ રાખવા પર પ્રતિબંધ.
- (૫) પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ.
- (૬) પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા /લાવવા લઈ જવા પર પ્રતિબંધ.

:: પ્રતિબંધિત વિસ્તાર ::

સુરત શહેર પોલીસ કમિશ્નરેટની હકુમત હેઠળની નીચે મુજબની સુરત શહેરની સ્કુલો/ હાઈસ્કુલોમાં પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ-૨ પરીક્ષા કેન્દ્રો તથા આસપાસનો ૧૦૦ મીટરનો વિસ્તાર

પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ-૨ ની પરીક્ષા કેન્દ્રોની વિગત દર્શાવતું પત્રક

અ. નં.	પરીક્ષા કેન્દ્રનું નામ (હાઈસ્કુલ)
૧	૨
૧	શેઠશ્રી પી.એચ.બચકાનીવાલા હાઈસ્કુલ ખરવર નગર ખટોદરા સુરત
૨	સીગમા હાઈસ્કુલ (ગુ.મિ), ક્ષેત્રપાળ મંદિરની બાજુમાં સગરામપુરા
૩	આર.ડી.કોન્ટ્રાક્ટર, નાનપુરા પો.સ્ટ ઓફિસની બાજુમાં નાનપુરા સુરત
૪	શ્રી આર.ડી ધાયલ જીવન ભારતી હાઈસ્કૂલ નાનપુરા ટીમલીયાવાડ સુરત
૫	જી.& જી.વી કડીવાલા સ્કુલ જે.પી.રોડ સેન્ટર પોઇ ન્ટ ની બાજુમાં સગરામપુરા સુરત
૬	શારદાયતન હાઈસ્કુલ ગુજરાતી મિડીયમ, પીપલોદ, સુરત
૭	કે.પી.સંઘવી વીદ્યાલય, યુનિટ-૧, શ્રી ભારતીમૈયા વિદ્યાસંકુલ વેસુ

૮	લાન્સર આર્મી સ્કુલ લંડન હાઉસ ડુમસ રોડ પીપલોદ વેસુ પાટીયા સુરત.
૯	ડો.એ.સી.લાપસીવાલા- યુનિટ-૧ અં.માધ્યમિક રૂઢનાથ મહાદેવ રોડ, મગદલ્લા, સુરત
૧૦	એસ.વી.પી.સેકન્ડરી સ્કુલ લેકવ્યુ ગાર્ડન, પીપલોદ સુરત.
૧૧	એમ.ટી.જરીવાલા માધ્યમિક શાળા ધીરજ સન્સની ગલીમા અઠવા લાઇન્સ સુરત
૧૨	રાયન ઇન્ટરનેશનલ શાળા ગુ.મા.,વેલેન્ટાઇન સિનેમા રૂઢનાથ મહાદેવ ડુમ્મસ રોડ સુરત
૧૩	સેન્ટઝેવિયર્સ હાઇસ્કૂલ ઘોડ્ડોડ રોડ સુરત
૧૪	સર થોમસ અં.મા. હાઇ સેકન્ડરી સ્કૂલ ,આર્શીવાદ વિલા સો.સીટી લાઇટ રોસ ભરથાણા વેસુ સુરત
૧૫	એસ.એન.ગુપ્તા લોકભારતી વિધાલય અશોક પાનની ગલીમાં,
૧૬	શ્રી વી.ડી.ટી. ગર્લ્સ સ્કુલ (સેલ્ફ ફાઇન્સ) વનિતા વિશ્રામ
૧૭	શેઠ ડી.આર.ઉમરીગર મેમોરીયલ સ્કુલ,અંગ્રેજી માધ્યમ, ઉમરા સુરત
૧૮	લુઈઝ કોનવેન્ટ, હાઇસ્કુલ ઇન્ડોર સ્ટેડીયમ સામે, અઠવાલાઇન્સ, સુરત.
૧૯	આર.એસ.એમ. પુણાવાલા , એક્ષપરિમેન્ટલ હાઇસ્કુલ અંબિકાનિકેતન પાર્લેપોઇન્ટ સુરત
૨૦	આઈ.જી.દેસાઈ, યુનિટ-૧, ભટાર ચાર રસ્તા, અલથાણા રોડ, સુરત
૨૧	શ્રી ડી.કે. ભટારકર વિદ્યાસંકુલ માધ્યમિક શાળા (ગુ.મા.) સીવાની પાર્ક અલથાણારોડ, સુરત
૨૨	શ્રી સત્યસાંઈ સ્કૂલ સેવા સંકુલ માર્ગ અલથાણા- ભરથાણા રોડ સુરત
૨૩	વિદ્યાભારતી હિન્દી વિદ્યાલય ભટાર ચાર રસ્તા ઉધાના-મગદલ્લા રોડ સુરત
૨૪	કર્મવિર એસ.કે. પટેલ વિદ્યાલય યુ.-૧ અર્જુન કોમ્પલેક્ષ ભટાર રોડ સુરત
૨૫	ધ પંચશીલ મર્કન્ટાઇલ કો.ઓ.પો.બેંક માધ્યમિક શાળા પાલનપુર પાટીયા રાંદેર રોડ
૨૬	પ્રેસીડેન્સી સ્કુલ માધ્યમિક શાળા યુનિટ-૦૨, પ્રગતિ સોસા. ન્યુ રાંદેર રોડ
૨૭	ધ રીડીયન્ટ ઇન્ટરનેશનલ શાળા ઉગત કેનાલ રોડ જહાંગીરાબાદ સુરત
૨૮	શ્રી સરસ્વતી વિદ્યાલય, હનીપાર્ક, અડાજણ, સુરત
૨૯	સીટીઝન સેકન્ડરી સ્કુલ, મંગલ તીર્થ એપાર્ટમેન્ટ, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત
૩૦	શ્રીમતિ વી.ડી.દેસાઈ વિદ્યાલય, સેકન્ડરી સ્કુલ, ભુલકા ભવન, અડાજણ મેઈન રોડ, સુરત
૩૧	એલ.એચ. બોધરા હાઇસ્કુલ,યુનિટ-૧ અડાજણ રોડ, પાણીની ટાંકી સામે, સુરત.

નોંધ :- સુરત શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ-૨ ની પરીક્ષા ના કુલ- ૩૧ કેન્દ્રો છે.

:: અપવાદ ::

વધુમાં હું આદેશ કરું છું કે આ હુકમ નીચે નાઓને લાગુ પડશે નહીં.

(૧) ઉપરોક્ત પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ-૨ ની પરીક્ષા કાર્યમાં રોકાયેલ વ્યક્તિઓને.

(૨) સરકારી નોકરીમાં અથવા રોજગારમાં ફરજ ઉપર હોય તેવી વ્યક્તિઓને

:: અમલવારીનો સમય ::

આ હુકમ તા.૦૩/૦૧/૨૦૨૧ ના ૬.૦૦/૦૦ થી તા.૦૩/૦૧/૨૦૨૧ ના કલાક:૧૮/૦૦ સુધી અમલમાં રહેશે.

:: શિક્ષા ::

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે સુરત કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબા ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

:: જાહેર વિજ્ઞપ્તિ ::

તમામને વ્યક્તિગત રીતે નોટીસની બજવાણી કરવી શક્ય ન હોય આથી એક તરફી હુકમ કરું છું. કે, જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાનપત્ર, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધી ધ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર, મદદનીશ પોલીસ કમિશ્નર, નાયબ પોલીસ કમિશ્નર તથા પોલીસ કમિશ્નર કચેરીના નોટીશ બોર્ડ ઉપર હુકમની નકલ ચોટાડી પ્રસિધ્ધી કરવામાં આવશે તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોટાડી પ્રસિધ્ધી કરવામાં આવશે. ગુજરાત પોલીસ એક્ટ કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત ગણાશે.

આજ તારીખ :- ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ મારી સહી અને સિક્કો કરી આપેલ છે.



(અજયકુમાર ભોમર)
પોલીસ કમિશ્નર,
સુરત શહેર.

પ્રતિ,

- (૧) અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર-૧, ૨ સુરત શહેર.
- (૨) અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફિક અને કાઇમ સુરત શહેર.
- (૩) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર.
- (૪) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી તમામ, સુરત શહેર.
- (૫) તમામ પો.સ્ટે.ઈન્ચાર્જશ્રીઓ, સુરત શહેર. (નકલો ચોટાડી લાઉડ સ્પીકર, વાહન ધ્વારા જાહેરાત કરાવવા સારૂ)
- (૬) તમામ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુરત શહેર.
- (૭) કંટ્રોલ ઈન્ચાર્જશ્રી, સુરત શહેર (તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ રવાના :-

- (૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગર.
- (૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગર.
- (૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગર.
- (૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર, રાજકોટ શહેર/વડોદરા શહેર.
- (૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત રેન્જ, સુરત.
- (૬) કલેક્ટરશ્રી, સુરત શહેર.
- (૭) મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, સુરત શહેર
- (૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટે.) સુરત રીજીયન, સુરત
- (૯) પોલીસ અધિક્ષકશ્રી, સુરત રૂરલ.
- (૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગર.
- (૧૧) જીલ્લા સરકારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુરત.
- (૧૨) મેનેજરશ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિધ્ધ કરવા સારૂ).
- (૧૩) પો.ઈન્સ.શ્રી, સુરત રેલ્વે પો.સ્ટે.
- (૧૪) રજીસ્ટ્રારશ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.
- (૧૫) રજીસ્ટ્રારશ્રી, ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, સુરત .
- (૧૬) રજીસ્ટ્રારશ્રી, ચીફ જ્યુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુરત.
- (૧૭) વધારાના એક્ઝીક્યુટીવ મેજી.શ્રી, સુરત શહેર. (નાનપુરા બહુમાળી સુરત)
- (૧૮) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. (જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત)
- (૧૯) સંયુક્ત માહિતી નિયામકશ્રી, સુરત (સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્દ્રમાં પ્રસિધ્ધ કરવા સારૂ)